

M.S.W Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2019 - [OLD COURSE]
LIFE SKILLS FOR SOCIAL WORK PRACTICE (ELECTIVE)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- | | | |
|----------|--|------|
| પ્રશ્ન.૧ | નિબંધાત્મક પ્રશ્નનો જવાબ આપો.
(1) જીવન કૌશલ્ય જરૂરિયાતો સમજાવો. | (૧૪) |
| | અથવા | |
| પ્રશ્ન.૧ | (1) જીવન કૌશલ્યનું મહત્વ જણાવો. | |
| પ્રશ્ન.૨ | નિબંધાત્મક પ્રશ્નનો જવાબ આપો.
(2) જીવન કૌશલ્યની પદ્ધતિઓ જણાવો. | (૧૪) |
| | અથવા | |
| પ્રશ્ન.૨ | (2) સ્વોટ એનાલીસીસ વિષે માહિતી આપો. | |
| પ્રશ્ન.૩ | નિબંધાત્મક પ્રશ્નનો જવાબ આપો.
(3) વાટાઘાટની કુશળતા વિષે સમજાવો. | (૧૪) |
| | અથવા | |
| પ્રશ્ન.૩ | (3) ભાવાત્મક બુધ્ધિ અને સહાનુભૂતિની ચર્ચા કરો. | |
| પ્રશ્ન.૪ | નિબંધાત્મક પ્રશ્નનો જવાબ આપો.
(4) જટિલ વિચાર વિષે માહિતી આપો. | (૧૪) |
| | અથવા | |
| પ્રશ્ન.૪ | સ્વ-સન્માનના ફાયદા જણાવો. | |
| પ્રશ્ન.૫ | ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે)
(1) ધ્યાન વિષે માહિતી આપો.
(2) ટીમવર્કના ફાયદા જણાવો.
(3) અભ્યાસની કુશળતા સમજાવો.
(4) હકારાત્મક વલણ વિષે માહિતી આપો. | (૧૪) |

ENGLISH VERSION

Que.1 Give the essay types answer. (14)
(1) Explain the needs of life skills.

OR

Que.1 (1) Explain the importance of life skills.

Que.2 Give the essay types answer. (14)
(2) Explain the methods of life skills.

OR

Que.2 (2) Give the information about SWOT analysis.

Que.3 Give the essay types answer. (14)
(3) Explain the negotiation skills.

OR

Que.3 (3) Explain the emotion intelligence and empathy in details.

Que.4 Give the essay types answer. (14)
(4) Give the information about critical thinking.

OR

Que.4 (4) Explain the benefits of self esteem.

Que.5 **Short notes: (any two)** (14)
(1) Give the information about meditation.
(2) Explain the benefits of team work.
(3) Explain the study skills.
(4) Give the information about positive attitude.
